

લગ્નમાં અવરોધ આવી રહ્યો છે? તો લગ્ન થાય તે માટેની

ચમત્કારિક ગુરૂચાવી

- ઝૂં ઋષિ પ્રિતેશભાઈ

જગતની દરેક વ્યક્તિને મુક્તિ કે મોક્ષની કામના હોય છે. આમ છતાં પણ માણસને વિવાહ-સંસ્કારમાં બંધાવાની કામના શું કામ હોય છે? આ પ્રશ્ન સર્વ સામાન્ય છે. જેનો ભારતીય વૈદિક શાસ્ત્રમાં આ પ્રમાણે ઉલ્લેખ છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં વર-વધૂનું વિવાહ બંધન એ માત્ર બંધન જ નથી પણ એ તો મુક્તિ અને મોક્ષનું સર્વોત્તમ સાધન છે. લગ્ન પાછળનો આશય બંનેમાં હૃદયનું મિલન છે, મનનો મેળાપ છે, આખું જીવન એકબીજાનાં સુખ-દુઃખમાં ભાગીદાર બનીને ચાલવાનું હોય છે. ગૃહસ્થાશ્રમથી લઈને વૃદ્ધાશ્રમ સુધીની જીવનનૈયા ચલાવવા માટે સાચો જીવનસાથી જરૂરી છે. જેમ પ્રાણીજીવને પ્રાણવાયુની આવશ્યકતા હોય છે તેમ દરેક સાંસારિક મનુષ્યને સાચા જીવનસાથીની હુંફની આવશ્યકતા હોય છે, જે લગ્નબંધનમાં જોડાવાથી પરિપૂર્ણ થાય છે.

પહેલાનાં સમયમાં વડીલો જેની સાથે નક્કી કરે તેની સાથે છોકરા-છોકરીઓએ લગ્નબંધનમાં બંધાઈને પોતાનો ઘરસંસાર ચલાવવાનો હતો. તેમાં છોકરા-છોકરીની પસંદગીને કોઈ સ્થાન ન હતું. પરંતુ આજનાં ભણેલા-ગણેલા ક્રાંતિકારી યુગમાં લગ્ન એક વિકટ સમસ્યા બનતી જાય છે. આજના ભણેલા ગણેલા યુવક યુવતીઓ અને તેમના મા-બાપ પણ જ્યાં સુધી એમના લાયક વેલસેટ યોગ્ય પાત્ર ના મળે અને છોકરા-છોકરીને ના ગમે ત્યાં સુધી લગ્ન કરતા કે કરાવતા નથી. જોકે આજના આધુનિક યુગમાં આ બાબત પણ વિચારવી અત્યંત જરૂરી છે. એવામાં જ્યારે દીકરા-દીકરીનું સમયસર લગ્ન ના થાય, યોગ્ય પાત્ર ના મળે, લગ્નમાં અવરોધ આવે, સમાજનાં લોકો જાતજાતની વાતો કરે આવી કંઈ કેટલીય ચિંતાઓ મા-બાપને અને સંતાનોને કોરી ખાતી હોય છે. પરંતુ મંત્રશાસ્ત્રમાં આના માટે પણ મંત્ર આપ્યા છે. જેના માધ્યમથી લગ્નઠચ્છુકોની લગ્ન કરવાની ઇચ્છા પૂર્ણ થાય એ ખાતરી સાથે હું આપની સમક્ષ એક સત્ય ઘટના રજૂ કરું છું.

જુલાઈ, 2010 માં એક પિતા તેમની દીકરીને લઈને મારી પાસે આવ્યા. તેઓએ પ્રણામ કરતા મને જણાવ્યું કે, “ગુરૂજી મારી દીકરીની ઉંમર 28 વર્ષની છે. તે એમ. કોમ. ભણેલી છે. અમે તેના માટે છેલ્લા ચાર વર્ષથી યોગ્ય જીવનસાથી શોધી રહ્યા છે. પરંતુ તેના લાયક કોઈ સારો છોકરો મળતો નથી. અમે તેના માટે લગભગ 60 થી 65 છોકરાઓ જોયા હશે પરંતુ તેમાં ક્યાંક અમારી છોકરીને છોકરો ન ગમે કે છોકરીને છોકરી ન ગમે, કુંડળી મેચ ના થાય, છોકરો ગમે તો કુટુંબ યોગ્ય ના હોય, બંનેને પાત્ર ગમતું હોય પણ કોઈ ત્રીજી વ્યક્તિ તેમ થવા ન દે, ભણતર ઓછું પડે આવા કંઈ કેટલાય અવરોધો આવ્યા કરે છે. હવે તો અમે થાકી ગયા છે. સમાજનાં લોકો પણ શાંતિથી જીવવા દેતા નથી. ગુરૂજી, અમે અમારી

દીકરી માટે યોગ્ય પાત્ર શોધવા ખૂબ મથામણ કરીએ છીએ પરંતુ ખબર નહી એનું લગ્ન નક્કી થતું જ નથી. આપ જ અમારા આ પ્રશ્નનું નિવારણ થાય તે માટે યોગ્ય ઉકેલ લાવી આપો.”

મેં પિતાની અને દીકરીની વાત સાંભળ્યા પછી તેમની દીકરીની હસ્તરેખા અને મુખમુદ્રા જોઈ મેં એમને કહ્યું કે, “આપની દીકરીનાં ભાગ્યમાં લગ્નયોગ થોડો મોડો છે પણ તેને સાડું પાત્ર જરૂર મળશે. આપ ચિંતા ન કરો. હું આપની દીકરીનાં લગ્ન વિના અવરોધે સારા પાત્ર જોડે નક્કી થાય તે માટે મંત્રસાગરમાંથી મોતીરૂપી મંત્ર આપું છું. આ મંત્રનો આપની દીકરી નિયમિત જાપ કરશે તો તેનું લગ્ન આઠ મહિનામાં ચોક્કસ નક્કી થઈ જશે.”

સાત મહિના પછી એ દીકરીનાં પિતા હસતા મુખે તેમની દીકરીનાં લગ્નની કંકોત્રી લઈને મારી પાસે આવ્યા. તેઓએ મને વંદન કરીને કહ્યું કે, “ગુરુજી આપે આપેલા મંત્રએ તો ખરેખર અમારા જીવનમાં એક ચમત્કાર જ સર્જ્યો છે. મારી દીકરીનું લગ્ન એક ખૂબ જ સારા, ભણેલા-ગણેલા, આર્થિક રીતે સદ્ગર અને સુશિક્ષિત કુટુંબનાં N.R.I. છોકરા સાથે નક્કી થયું છે. અમારે અમારી દીકરી માટે જીવનમાં જેવા જીવનસાથીની તલાશ હતી તે આજે પૂરી થઈ ગઈ છે. અમારી દીકરીને એવા આર્શીવાદ આપો કે તેનું દામ્પત્યજીવન સુખ-સમૃદ્ધિ સભર વીતે અને આપની કૃપા સદાય અમારા પર બની રહે.”

લગ્ન ના થતા હોય તેવા યુવક-યુવતીઓને અને આવા સંતાનોની ચિંતા કરતા મા-બાપને પણ હું આજે મંત્રસાગરમાંથી એ યુવતીને આપેલો મંત્ર આપું છું.

મંત્ર : || ॐ ત્રુજા ત્રુજા શષતિતા વામક્ય નમઃ ||

આ મંત્ર ગણવાની રીત:

સૌપ્રથમ એક સ્ટીલની વાડકીમાં પાણી લઈ અનામિકા આંગળી પાણીમાં રાખી ઉપરનો મંત્ર 45 વખત ગણી અને એક વખત ॐકાર ચાલીસા ગણી પાણી પી જવું. આ મંત્ર કોઈપણ સમયે કરી શકાય. આ મંત્ર ગણતી વખતે લીલા કલરનાં વસ્ત્ર પહેરવા. આ મંત્રથી સગપણ અને લગ્નમાં જે અવરોધ હશે તે ચોક્કસ દૂર થશે.

|| ॐ નમઃ ||